

(2)

29/5/55



REGISTERED NO. L 2/RNP/GG/GNR-84
प्राप्ति दायरेपाने रु. 3.300/-

(C)

The Gujarat Government Gazette

EXTRAORDINARY

PUBLISHED BY AUTHORITY

Vol. LV]

FRIDAY, JUNE 20, 2014/JYAISTA 30, 1936

Separate paging is given to this Part in order that it may be filed as a Separate Compilation.

PART. IV-B

Rules and Orders (Other than those published in Part I, I-A and I-L) made by the
Government of Gujarat under the Gujarat Acts.

સાચાન્ય વહીવટ વિભાગ,

જેડેરન્ચાસું

સચિવાલય, ગાંધીનગર.

તારીખ: ૨ ફ્લી ફેબ્રુઆરી, ૨૦૧૪.

ગુજરાત (જેડેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩.

ક્રમાંક: છાંસેસ /૭/૨૦૧૪/એનાથી -૧૦૨૦૧૩/૮૧૭ /એચારટીડી-૧: ગુજરાત (જેડેર સેવાઓ અંગેનો
નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩ (સન ૨૦૧૩ના ગુજરાતના ૧૬મા)ની કલમ ૧ની પેટા-કલમ (૩)થી જગેલી
સત્તાની રૂથે, ગુજરાત સરકાર, આથી, સદરહુ અધિનિયમની કલમ ૪ અને કલમ ૨ટની જોગવાઈઓ જે તારીખે અમલમાં
પણે તે તારીખ તરીકે સન ૨૦૧૩ના ફેબ્રુઆરી મહિનાની ૨ ફ્લી તારીખ નકિ કરે છે.

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

ભરત બી. પટેલ,
સરકારના નાયબ સચિવ.

સામાન્ય વહીવટ વિભાગ,

જીડેરનાસું

સચિવાલય, ગાંધીનગર,

તારીખ: ૨૬મી ફેબ્રુઆરી, ૨૦૧૪.

ગુજરાત (જીડેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) નિયમો, ૨૦૧૪.

ક્રમાંક: શ્રેષ્ઠ /૮/૨૦૧૪/નેનાયી - ૧૦૨૦૧૩/૮૧૭/અધિનિયમ - ૧: ગુજરાત (જીડેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩ (સન ૨૦૧૩ના ગુજરાતના ૧૬મા)ની કલમ ૨૮થી મળેલી સંસ્તાની રૂએ, ગુજરાત સરકાર, આધી, નીચેના નિયમો કરે છે:-

૧. દૂંકી સંશો અને આરંભ.-

- (૧) આ નિયમો ગુજરાત (જીડેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) નિયમો, ૨૦૧૪ કહેવાશે.
(૨) તે શબ્દપ્રમાણાં તેની માસિદ્ધિની તારીખે અમલમાં આવશે.

૨. વ્યાખ્યા.-

- (૧) આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો,-

- (ક) “અધિનિયમ” એટલે ગુજરાત (જીડેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩;
(ખ) “નમૂનો” એટલે આ નિયમો સાથે જોડેલો નમૂનો;
(ગ) “જીડેર કરેલી સેવાઓ” એટલે અધિનિયમની કલમ ૪ ડેટા રાજ્ય સરકારે જીડેર કરેલી સેવાઓ;
(ઘ) “ઠરાવેલો નમૂનો” એટલે અધિનિયમની કલમ ૪ ડેટાની જીડેર કરેલી સેવાઓ પૂરી પાડતા સંબંધિત વિભાગ-એ ઠરાવેલો નમૂનો;
(ઝ) “કલમ” એટલે અધિનિયમની કલમ.

- (૨) આ નિયમોમાં વાપરેલા પણ વ્યાખ્યાયિત ન કરેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો, અધિનિયમમાં તેમનો જે અર્થ કરવામાં આવ્યો છે તે જ થશે.

૩. મુકરર અધિકારીઓ, ફરિયાદ નિવારણ અધિકારીઓ અને મુકરર સત્તાઅધિકારીના નામ પ્રસિદ્ધ કરવા બાબત.- અધિનિયમની કલમ ૫, કલમ ૬ અને કલમ ૮ (૨) મુજબ, જીડેર સત્તામંડળ-એ, રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાના, ખૂનિસિપલ કોર્પોરેશનો, નગરપાલિકાઓ, નોટિકાઇઝ એરિયા, પંચાયતોના, તમામ વહીવટી એકમો અથવા કચેરીઓમાંના અને એવી બીજી કચેરીઓમાંના તેના મુકરર અધિકારીઓ, ફરિયાદ નિવારણ અધિકારીઓ અને મુકરર સત્તાઅધિકારીના નામ અને સરનામાં પ્રસિદ્ધ કરવા જોઈશે. મુકરર અધિકારીઓ અને ફરિયાદ નિવારણ અધિકારીઓના નામ, સરનામાં, ઈ-પેરેલ આઈ.ડી., કોન્ટેક્ટ ટિલ્ફોન નંબર, ફેક્સ નંબર, દરેક જીડેર સત્તામંડળ અથવા કસ્ટમર ટેર સેન્ટર અથવા ડેલ્વ એક્સ અથવા જન સેવા કેન્દ્ર અને વેચાજા કેન્દ્ર (sales outlet), હોય તો, તેની વેબસાઈટ ઉપર પણ પ્રદર્શિત કરવા જોઈશે.

૪. નોટિસ બોર્ડ ઉપર માહિતી પ્રદર્શિત કરવા બાબત.- જીડેર સત્તામંડળના મુકરર અધિકારી અને તેના તાબાના જીડેર (રાજ્ય) સેવકે, સામાન્ય જનતાની સુગમતા માટે, તેમની કચેરીમાંની ઉપલબ્ધ જીડેર કરેલી સેવાઓના સંબંધમાં, નમૂના-“ક” મુજબની તમામ સંબંધિત માહિતી, તેમની કચેરીની બાહ્યાની બાજુઓ નોટિસ બોર્ડ ઉપર પ્રદર્શિત કરાવડાવવી જોઈશે. આવા નોટિસ બોર્ડ કચેરીની સ્થાને પ્રદર્શિત કરવા જોઈશે. અરજીઓ સ્વીકારવા માટે, ઠરાવેલા (નિયત) અરજી પત્રકોની પૂરતી સંખ્યામાં નકલો કાઉન્ટરમાં ઉપલબ્ધ રાખવી જોઈશે.

23/2A
5/1

૫. અરજી સ્વીકારવાની અને અરજદારોને તેની પહોંચ આપવાની રીત.-

- (૧) અધિનિયમની કલમ ઉઠી મળેલા અધિકારોનો ઉપયોગ કરવા માટે, સેવા/સેવાઓ મેળવવા ખાંગતા નાગરિક, અધિનિયમની કલમ ઇ ડેટન રાજ્ય સરકાર જાહેર કર્મ પ્રમાણેની એક અથવા વિસ્તૃત સેવાઓ (મેળવવા) માટે, ઠારોવેલા અરજના નમૂના પ્રમાણે અથવા બીજા કોઈ નમૂના પ્રમાણે, ક્યેરીમાંં ઉપલબ્ધ હોય તેવી તપાસ યાદી (check-list)માં ઠારોવેલા દસ્તાવેજો સહિત, મુકર અધિકારીને અંગુજી કરવી જોઈશ.
 - (૨) મુકર અધિકારી અથવા અધિકૃત વ્યક્તિએ, લેખિત અરજી અથવા જ્યાં ઠારોવામાં આવેલ હોય તાં તેવા નમૂનામાંની અરજી મળેથી, અરજી કર્યાની તારીખથી કામકાજના ગજ દિવસની અંદર, નમૂના ખમાં, અરજદારને યોગ્ય પહોંચ આપવી જોઈશ.
 - (૩) અરજની સાથે જરૂરી દસ્તાવેજો બીડવામાં આવેલા ન હોય તેવા ડિસ્સાનાં, તે બાબત સ્પષ્ટપણે પહોંચમાં જણાવવી જોઈશ અને આવી પહોંચમાં સેવા પૂરી પાડવા અંગેની તારીખ જણાવવી જોઈશ નહિ.
 - (૪) અરજની સાથે તમામ જરૂરી દસ્તાવેજો બીડવામાં આવેલા હોય અને અરજી તમામ સંદર્ભમાં સંપૂર્ણ હોય, ત્યારે સેવા પૂરી પાડવા અંગેની તારીખ જણાવવી જોઈશ.
- જાહેર રજાઓને સમાવેશ ન કરવા બાબત - સેવા પૂરી પાડવા માટેની નિયત સમયમર્યાદાની ગણતરી કરતી વખતે, જાહેર રજાઓને ગડતરીમાં લેવી જોઈશ નહિ.

૬. કીમાં દૂટાણ આપવા બાબત - ફરિયાદ નિવારણ અધિકારી, મુકર અપીલ સત્તાધિકારી અને રાજ્ય અપીલ સત્તાંદર્ભને કરવામાં આવતી અરજી માટે કોઈ ફી લેવી જોઈશ નહિ.

૭. ફરિયાદ સ્વીકારવા (મેળવવા) માટેની રીત - (૧) જાહેર કરેલી સેવાઓ પૂરી પાડવામાં આવી ન હોય અથવા ઠારોવેલી સમય-મર્યાદાની અંદર પૂરી પાડવામાં આવી ન હોય તેવા ડિસ્સાનાં, નારાજ થયેલ નાગરિક, શક્ય હોય તાં સુધી, નમૂના - "ગ"માં ઠારોવા પ્રમાણેના નમૂનામાં, અધિનિયમની કલમ ઇ ડેટન જાહેર સત્તાંદર્ભને જીવેલા સંબંધિત ફરિયાદ નિવારણ અધિકારીને, હાથોહાથ, ફેક્સ, પોસ્ટ અથવા રાઇસર્ટ પોસ્ટ મારફત લેખિત ફરિયાદ રજૂ કરવી જોઈશ.

(૨) ફરિયાદ નિવારણ અધિકારીએ, લેખિત ફરિયાદ મળેથી, ફરિયાદ કર્યાની તારીખથી કામકાજના ગજ દિવસોની અંદર, અરજદારને, નમૂના - "ખ" મુજબની યોગ્ય પહોંચ આપવી જોઈશ.

૮. નોટિસ આપવાની રીત - (૧) ફરિયાદ નિવારણ અધિકારીએ, ઠારોવેલી સમયમર્યાદાની અંદર સેવા / સેવાઓ પૂરી પાડવામાં વિલંબ કરવા માટે અથવા કસૂર કરવા માટે જવાબદાર હોય તેવા મુકર અધિકારી અથવા તાબાના કર્મચારીને નોટિસ આપવી જોઈશ. તેમણે, વિલંબ કરનાર અધિકારી અથવા કર્મચારીએ જે સમયમર્યાદાની અંદર નોટિસનો જવાબ રજૂ કરવો જોઈશ તે સમયમર્યાદા પણ દર્શાવવી જોઈશ.

(૨) ફરિયાદ નિવારણ અધિકારીએ, સેવા / સેવાઓ પૂરી પાડવા માટે જવાબદાર મુકર અધિકારી અથવા તાબાના કર્મચારીએ રજૂ કરેલા મુલાયાથી સંતોષ ન થાય; તો ફરિયાદ નિવારણ અધિકારીએ નિયમ ૧૦ મુજબ આગળની કાર્યવાહી કરવી જોઈશ.

૯. સુનાવણી અંગેની માહિતીની જાણ કરવા બાબત - (૧) ફરિયાદ નિવારણ અધિકારીએ (હાથ ધરવાની) ફરિયાદની સુનાવણી અંગેની માહિતીની જાણ, ફરિયાદ નિવારણ અધિકારીએ, નીચે જણાવેલી રીતો પૈશની કોઈપણ એક રીતે કરવી જોઈશ,-

- (૩) હાથોહાથ;
- (૫) પોસ્ટ દ્વારા;

(૧) ટેલિફોન / ડેક્સ / ઈ-મેઈલ / એસએમેચેસ (અરજદારે ગતી સંદેશાવ્યવહાર માટે ૦૪ વિકલ્પ પસંદ કરેલ હોય તેના) વારા;

(૨) ફરિયાદી અને / અથવા યથાપ્રસંગ, મુકરર અધિકારીને ઓછામાં ઓછા સાત દિવસ અગ્રાઉ સુનાવણીની તારીખની જાણ કરવી જોઈશે.

(૩) અરજદાર અથવા યથાપ્રસંગ, મુકરર અધિકારીએ પોતે સુનાવણી દરમિયાન હાજર રહેવું જોઈશે.

(૪) કોઈપણ પદ્ધતિને સુનાવણી અંગેની બાહિતીની ચોંચ રીતે જાણ કરવામાં આવેલ હોય તેનું છતાં, તે સુનાવણીની તારીખે ગેરહાજર રહે, તો અંગે એક-તારીખ નિર્ણય કરવામાં આવશે.

૧૧. ફરિયાદ અંગે નિર્ણય કરવા માટેની કાર્યવીતિ:- (૧) ફરિયાદ નિવારણ અધિકારીએ, મુકરર અધિકારીના હુકમું અથવા કલમ ૬ હેઠળ કરવામાં આવેલી ફરિયાદ અંગે નિર્ણય કરવા માટે નિયેની કાર્યવાહી કરવી જોઈશે,-

(૧) સંબંધિત દસ્તાવેજો, જહેર રેક્રૂટ અથવા તેની નકલોની સમીક્ષા કરવી.

(૨) અપવાદરૂપ સંજોગોમાં, જરૂરી તપાસ કરવા માટે બીજા કોઈ અધિકારીને અધિકૃત કરી શકાશે.

(૩) સુનાવણીના સમયે, મુકરર અધિકારી અથવા યથાપ્રસંગ, તાબાના કર્યારીને બોલાવી શકાશે.

(૨) ફરિયાદ નિવારણ અધિકારીના નિર્ણયની સાથે, આવા નિર્ણય પર પહોંચવા માટેના કારણો જોડેલા હોવા જોઈશે.

(૩) ફરિયાદ નિવારણ અધિકારીએ, તેને કરવામાં આવેલી અપીલનો, ગ્રીસ દિવસની અંદર નિકાલ કરવો જોઈશે.

(૪) ફરિયાદ નિવારણ અધિકારીએ, જે ફરિયાદનું નિવારણ ન થયેલ હોય તેવી દરેક ફરિયાદ અંગેનો રિપોર્ટ, ફરિયાદોની વિગતો અને તેના પ્રકાર અને ફરિયાદનું નિવારણ ન થઈ શકવા અંગેના કારણો સહિત હુકમની તારીખથી પંદર દિવસની અંદર, મુકરર સત્તાઅધિકારીને મોકલવો જોઈશે.

૧૨. ફરિયાદ નિવારણ અધિકારીએ હુકમની જાણ કરવા બાબત:- (૧) ફરિયાદ નિવારણ અધિકારીએ, હુકમની તારીખથી સાત દિવસની અંદર, સંબંધિત પદ્ધતિને નિર્ણયની નકલો મોકલવા અંગેની વ્યવસ્થા કરવી જોઈશે.

(૨) મુકરર અધિકારી અથવા તેના તાબાના જહેર (રાજ્ય) સેવકની સામે, કલમ ૮ (૧) (ગ) અથવા યથાપ્રસંગ, (૬) હેઠળ શિસ્તવિષયક કાર્યવાહી કરવા માટેની ભલામણ કરવાના પ્રસંગે, ફરિયાદ નિવારણ અધિકારીએ, તેમની સામે કરવામાં આવેલા હુકમો, સંબંધિત જહેર સત્તામંડળ અથવા ચોંચ સત્તાઅધિકારીને મોકલવા જોઈશે.

૧૩. મુકરર સત્તાઅધિકારી સમક્ષ પ્રથમ અપીલ:- (૧) અધિનિયમની કલમ ૧૦ની પેટા-કલમ (૨) મુજબ, ફરિયાદ નિવારણ અધિકારીના નિર્ણયથી નારાજ થયેલી ગોઈપણ વ્યક્તિ ફરિયાદ નિવારણ અધિકારીના હુકમની નકલ ભલામણી તારીખથી ગ્રીસ દિવસની અંદર, શક્ય હોય ત્યા સુધી નમૂના ઘણ્ણો ઠરાવવામાં આવ્યા મુજબના નમૂનામાં મુકરર સત્તાઅધિકારીને અપીલ કરી શકશે.

(૨) કલમ ૮ની પેટા-કલમ (૧) હેઠળ મોકલવામાં આવેલ દરેક ફરિયાદ, અપીલ તરીકે દાખલ કરવામાં આવી હોલાનું ગણાશે.

- (3) આવી અપીલ મળ્યાની સર્વીકૃતિની પહોંચ, કામકાજના ત્રણ દિવસની અંદર, નમૂના-“ઝા” મુજબ આપવી જોઈશે.
- (4) દરેક અપીલનો, તે અપીલ દાખલ થયેલી હેવાનું જણાતી તારીખથી અથવા અરજદાસે અપીલ દાખલ કર્યાની તારીખથી પિસ્તાણીસ દિવસની અંદર નિકાલ કરવો જોઈશે.
- (5) તમામ અપીલનો નિકાલ, નીચેની રીતે કરવો જોઈશે:
- (1) ફરિયાદીને, સંબંધિત ફરિયાદ નિવારણ અધિકારીને અને મુકરર અધિકારીને ઓછાખાડો ઘોણ સાત દિવસ અગાઉ સુનાવણીની તારીખની જાણ કરવી જોઈશે.
 - (2) ફરિયાદી, મુકરર અધિકારી અને ફરિયાદ નિવારણ અધિકારીએ પોતે સુનાવણી દસ્તખ્યાન હાજર રહેવું જોઈશે.
 - (3) સુનાવણી અંગેની તેને યોગ્ય રીતે જાણ કરવામાં આવી હોય તે ઉત્તી, કોઈપણ પક્ષકાર સુનાવણીની તારીખે ગેરહાજર રહે, તો, તે અરજુ અંગે એકતરફી નિર્ણય કરવામાં આવશે.
 - (4) મુકરર સત્તાધિકારીએ, હુકમની તારીખથી પદર દિવસની અંદર, સંબંધિત પક્ષકારોને નૈદ્યાનિ નકલો ઘોડલવાની વ્યવસ્થા કરવી જોઈશે.
 - (5) મુકરર સત્તાધિકારીએ, કલમ ૨૩ ની પેટા-કલમ (૧) હેઠળ દંડ નાખવામાં આવે તે પહેલાં, સંબંધિત અધિકારીને સાંભળવા જોઈશે (સુનાવણીની તક આપવી જોઈશે).
 - (6) મુકરર સત્તાધિકારીએ, કલમ-૧૦ની પેટા-કલમ (૭) હેઠળ કોઇ પગલું લેવાનું જણાય તો તેણે, સુનાવણીના પદર દિવસની અંદર તેની સમુચ્ચિત સત્તામંડળને લેખિતમાં જાણ કરશે.
 - (7) મુકરર સત્તાધિકારીએ, સેવાઓ પૂરી પાડવા માટે અધિનિયમની કલમ ૪ હેઠળ બહાર પાડેલા જહેરનામણાના પાલન અથે સંબંધિત જહેર સત્તામંડળને જરૂરી હોય તેવા ખાસ પગલાં લેવા અંગે સુનાવણીના પદર દિવસની અંદર, લેખિતમાં જાણ કરવી જોઈશે.
 - (8) રાજ્ય અપીલ સત્તામંડળ.- (૧) એક અથવા વધુ રાજ્ય અપીલ સત્તામંડળ રહેશે અને દરેક રાજ્ય અપીલ સત્તામંડળમાં રાજ્ય સરકારે નીમેલા વધુમાં વધુ ત્રણ સભ્યો રહેશે.
 - (૨) રાજ્ય અપીલ સત્તામંડળના સભ્યોના પગાર અને લઘ્યાં; તેમની નિમણૂક કરવામાં આવેલી હોય તે પહેલાં તે જ હોકી ધરાવતા હોય તે હોકી અથવા તે રાજ્ય સરકારમાં ઉલ્લે જ હોકી ધરાવતા હોય તેને સમકક્ષ રહેશે.
 - (૩) રાજ્ય સરકાર, યોગ્ય તપાસ કર્યા પછી, રાજ્ય અપીલ સત્તામંડળના સભ્યને, સાબિત થયેલ ગેરવત્યૂક અથવા અસમર્થતાના કારણસર તેના હોકા પરથી દર કરી શકશે.
 - (૪) રાજ્ય સરકાર અપીલ સત્તામંડળના સભ્યને, જરૂરી જણાય તો ફરજ-મોકૂફ કરી શકશે, તપાસ દરમિયાન કચેરીમાં હાજર રહેવા પર પણ પ્રતિબંધ મંડી શકશે. તપાસ રાજ્ય સરકારે કરવી જોઈશે. સભ્યની ગેરવત્યૂક અથવા અસમર્થતાના ડિસ્સામાં, રાજ્ય સરકાર, આરોપની તપાસ કરવા માટે, અભિલ ભારતીય સેવાના વરિઝ અધિકારી અથવા અધિકારીઓનું બનેલું તપાસ મંડળ(બોર્ડ) નીચી


શક્તી. તપાસ મેડિના રિપોર્ટને આધારે, રાજ્ય સરકાર આરોપ મૂકવામાં આવ્યો હોય તે સંબંધ વિરુદ્ધ જીવિત પગલાં લઈ શક્તી.

૧૫. રાજ્ય અપીલ સત્તામંડળ સમક્ષ દિતીય અપીલ-(૧) અપીલની તારીખથી પિસ્તાનીસ દિવસની અંદર, મુકરર સત્તાધિકારીનો નિર્ણય જેણે ન મળે તેવી અથવા મુકરર સત્તાધિકારીના નિર્ણયથી નારાજ થયેલી કોઈપણ વ્યક્તિ, આવી મુદ્ત સમાપ્ત થાય તેના અથવા યથાપસંગ, મુકરર સત્તાધિકારીના હુકમની નકલ મજ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર, શક્ત હોય ત્યાં સુધી નમૂના-ઘા-માં કરાવવામાં આવ્યા મુજબના નમૂનામાં રાજ્ય અપીલ સત્તામંડળ સમક્ષ દિતીય અપીલ કરી શક્તી.
- (૨) આવી દિતીય અપીલ મજ્યાની સ્લીકૃતિની પહોંચ કામકાજના ત્રણ દિવસની અંદર, નમૂના-ઘા મુજબ આપવી જોઈશે.
- (૩) તમામ અપીલનો નિકાલ, નીચેની રીતે કરવો જોઈશે:
 - (૧) ફરિયાદી, સંબંધિત ફરિયાદ નિવારણ અધિકારી, સંબંધિત મુકરર સત્તાધિકારી અને મુકરર અધિકારીને ઓછામાં ઓછા સાત દિવસ અંગાઉ સુનાવણીની તારીખની જાણ કરવી જોઈશે.
 - (૨) સંબંધિત ફરિયાદી, મુકરર અધિકારી, ફરિયાદ નિવારણ અધિકારી અને મુકરર સત્તાધિકારીએ પોતે સુનાવણી દરમિયાન હાજર રહેવું જોઈશે.
 - (૩) સુનાવણી અંગેની તેને યોગ્ય રીતે જાણ કરવામાં આવી હોય તે છતાં, કોઈથણે પક્ષ સુનાવણીની તારીખે ગેરહાજર રહે, તો, તે અરજી અંગે એકતરફી નિર્ણય કરવામાં આવશે.
 - (૪) અપીલ સત્તામંડળે હુકમ થયાની તારીખથી પંદર દિવસની અંદર, સંબંધિત પક્ષકારોને, નિર્ણયની નકલો મોકલવાની વિષય કરવી જોઈશે.
 - (૫) અપીલ સત્તામંડળે, કલમ ૨૩ ની પેટા-કલમ (૧) હેઠળ ઈંડ નાખવામાં આવે ને પહેલાં, સંબંધિત અધિકારીને સંબંધિત જીવિતની તક આપવી જોઈશે.
 - (૬) અપીલ સત્તામંડળને, કલમ-૧૦ની પેટા-કલમ (૭) હેઠળ કોઈ પગલું લેવાનું જણાય, તો તેથે, સુનાવણીના પંદર દિવસની અંદર તેની સખ્તીની સત્તામંડળને લેખિતમાં જાણ કરશે.
 - (૭) અપીલ સત્તામંડળે, સુનાવણીના પંદર દિવસની અંદર, સેવાઓ પૂરી પાડવા માટે અધિનિયમની કલમ ૪ હેઠળ બહાર પાડેલા જહેરનામાના પાલન અંગે સંબંધિત જહેર સત્તામંડળને જરૂરી હોય તેવા ખાસ પગલાં લેવા અંગે, લેખિતમાં જાણ કરવી જોઈશે.
 ૧૬. રિપોર્ટ પ્રસ્તિક કરવાની રીત.- દરેક જહેર સત્તામંડળે, અધિનિયમની કલમ ૨૪ની પેટા-કલમ (૨) હેઠળ કેલેન્ડર વર્ષના અંતે, ત્રણ મહિનાની અંદર, પુસ્તક સ્વરૂપે વાર્ષિક રિપોર્ટ પ્રસ્તિક કરવો જોઈશે અને રાજ્યના સંબંધિત વહીવટી વિભાગને તે મોકલવો જોઈશે.
 ૧૭. અધિનિયમ હેઠળના તમામ કેસોનો રેકર્ડ નિબાવવા બાબત.- મુકરર સત્તાધિકારીએ, ફરિયાદ નિવારણ અધિકારીએ, મુકરર સત્તાધિકારીએ અને આપીલ સત્તામંડળો લીધેલા પગલાંના સંબંધમાં તમામ કેસોનું રેકર્ડ, અનુકૂળ નમૂના-ઘા-૧", નમૂના-ઘા-૨", નમૂના-ઘા-૩" અને નમૂના-ઘા-૪"-માં નિબાવતું જોઈશે અને તેની સામનીક (મુદતી) રિપોર્ટ જહેર સત્તામંડળના વડાને મોકલવો જોઈશે.

૨

શક્રો. તપાસ મંડળના રિપોર્ટને આધારે, રાજ્ય સરકાર આરોપ મુકવામાં આવ્યો હોય તે સલ્લન્ય વિન્દુ ઉચિત પગલાં લઈ શકો.

૧૫. રાજ્ય આપીલ સત્તામંડળ સમક્ષ દિતીય અપીલ-(૧) અપીલની તારીખથી પિસ્તાળીએ દિવસની અંદર, મુકર સત્તાપિકારીનો નિશ્ચય જેને ન મેળે તેવી અથવા મુકર સત્તાપિકારીના નિર્ણયથી નારાજ થયોલી કોઈપણ વ્યક્તિ, આવી મુદ્દ સમાપ્ત થાય તેના અથવા યથાપસંગ, મુકર સત્તાપિકારીના હુકમની નકલ મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર, શક્ર હોય ત્યાં સુધી નમૂના-ચ્ય-મો દરાવવામણી આવ્યા મુજબના નમૂનામાં રાજ્ય આપીલ સત્તામંડળ સમક્ષ દિતીય અપીલ કરી શકો.
- (૨) આવી દિતીય અપીલ મળ્યાની સ્થીકૃતિની પહોંચ કામકાજના ત્રણ દિવસની અંદર, નમૂના-ચ્ય-મો મુજબ આપવી જોઈશે.
- (૩) તમામ આપીલનો નિકાલ, નીચેની રીતે કરવો જોઈશે-
- (૧) ફરિયાદી, સંબંધિત ફરિયાદ નિવારણ અધિકારી, સંબંધિત મુકર સત્તાપિકારી અને મુકર અધિકારીને ઓછામાં ઓછા સાત દિવસ અગાઉ સુનાવણીની તારીખની જાણ કરવી જોઈશે.
 - (૨) સંબંધિત ફરિયાદી, મુકર અધિકારી, ફરિયાદ નિવારણ અધિકારી અને મુકર સત્તાપિકારીએ પોતે સુનાવણી દરમિયાન હજર રહેવું જોઈશે.
 - (૩) સુનાવણી અંગેની તેને ચોંગ્ય રીતે જાણું કરવામાં આવી હોય તે છતી, કોઈપણ પક્ષ સુનાવણીની તારીખે ગેરહજર રહે, તો, તે અરજી અંગે એકતરફી નિર્ણય કરવામાં આવશે.
 - (૪) આપીલ સત્તામંડળે હુકમ થયાની તારીખથી પદર દિવસની અંદર, સંબંધિત પક્ષકારોને, નિર્ણયની નકલો મોકલવાની વ્યવસ્થા કરવી જોઈશે.
 - (૫) આપીલ સત્તામંડળે, કલમ ૨૩ ની પેટા-કલમ (૧) હેઠળ હંડ નામનામાં આવે જો પહેલાં, સંબંધિત અધિકારીને સાંલાલવા જોઈશે (સુનાવણીની તરફ આપવી જોઈશે).
 - (૬) આપીલ સત્તામંડળને, કલમ-૧૦ની પેટા-કલમ (૭) હેઠળ કોઇ પગલું લેવાનું જણાય, તો, તેણે, સુનાવણીના પદર દિવસની અંદર તેની સંગૃદ્ધિત સત્તામંડળને લેખિતમાં જાણ કરશે.
 - (૭) આપીલ સત્તામંડળે, સુનાવણીના પદર દિવસની અંદર, સેવાઓ પૂરી પાડવા માટે અધિનિયમની કલમ ૪ હેઠળ બહાર પાડેલા જરૂરેનમાના પાદાન અથે સંબંધિત જહેર સત્તામંડળને જરૂરી હોય તેવા ખાસ પગલીં લેવા અંગે, લેખિતમાં જાણ કરવી જોઈશે.
૧૬. રિપોર્ટ પ્રસ્તિક કરવાની રીત- દરેક જહેર સત્તામંડળે, અધિનિયમની કલમ ૨૪ની પેટા-કલમ (૩) હેઠળ કેલેન્ડર વર્ષના અંતે, ત્રણ મહિનાની અંદર, પુસ્તક સ્પરૂપે વાણિક રિપોર્ટ પ્રસ્તિક કરવો જોઈશે અને રાજ્યના સંબંધિત વહીવાની વિભાગને તે મોકલવા જોઈશે.
૧૭. અધિનિયમ હેઠળના તમામ કેસોનો રેકર્ડ નિલાલવા બાબત- મુકર સત્તાપિકારીએ, ફરિયાદ નિવારણ અધિકારીએ, મુકર સત્તાપિકારીએ અને આપીલ સત્તામંડળે લીધેલા પગલાંના સંબંધમાં તમામ કેસોનું રેકર્ડ, અનુકૂમે નમૂના-ચ્ય-૧", નમૂના-ચ્ય-૨", નમૂના-ચ્ય-૩" અને નમૂના-ચ્ય-૪"માં નિલાલવું જોઈશે અને તેનો સામનીદિ (મુદતી) રિપોર્ટ જહેર સત્તામંડળના વડાને મોકલવા જોઈશે.



29 (2) (2)

१८. (માહિતી)નો પસાર અને તાલીમના રજ્યા સરકાર, નાણાકીય અને અન્ય સંસાધનોની ઉપલબ્ધતાના
પ્રમાણ મુજબ.

(૫) ખાસ કરીને લાભથી વંચિત હોય તેવા સમૃદ્ધાયોમાં, અધિનિયમ હેઠળના અપેક્ષિત આપિકારોનો
ઉપયોગ કઈ રીતે કરવો તે હેતુસર, જાહેર જનતામાં તે અંગેની સમજશક્તિ વધારવા માટે
અલેખાનો અને કાર્યક્રમો વિકસાનવા અને તેનું આયોજન કરવું અને જાહેર સત્તામંડળોને આવા
કાર્યક્રમોમાના વિકાસ અને આયોજનમાં લાગ લેવા માટે પ્રત્યાહિત કરવા જોઈશે.

(૬) અધિનિયમની સંબંધિત જોગવાઈઓનો શાખાઓ અને કોલેજોના સંસ્કારકમાં સમાવેશ થાય તે
માટે પગલા લેવા જોઈશે, જીથી કરીને અધિનિયમ વિશે નાગરિકોને શિક્ષિત કરી શકાય;

(૭) અધિનિયમનો અસરકારક રીતે અમલ કરાવવા માટે સ્ટાફ અને માળખાડીય સુલિદા પરી પાડવી
જોઈશે.

(૮) જાહેર સત્તામંડળોએ, નાગરિકો માટે જાહેર કરેલી સેવાઓ અને સમયોચિતતા અને અરજુઓની
પરીક્ષા અંગે મચ્છોટ માહિતી સમયસર આપવી જોઈશે અને તેનો અસરકારક પસાર કરવો જોઈશે.

(૯) મુહર્રત અપિકારીઓ, કરિયાદ નિવારણ અપિકારીઓ અને ચથાપસંગ, આપીલ સત્તામંડળના હૃતાકને,
અધિનિયમ હેઠળની તેમની ફરજો અંગે તાલીમ આપવી જોઈશે.

(૧૦) આ અધિનિયમ હેઠળ નિર્દિષ્ટ કરુણામાં આવેલ કોઇપણ અધિકારનો ઉપયોગ કરવા આગતી હોય
તેવી કોઇરબ્યાન્ડને વાજળી રીતે જરૂર પડ ત્યારે સરળતાથી સમજ શકાય તેવા સ્વરૂપમાં અને
તેવી રીતે આવી માહિતી પરાવતી માર્ગદર્શિકાઓ તૈયાર કરવા રજ્યા સરકારના સંબંધિત
વિલાગોને આદેશ આપવો જોઈશે.

૧૯. અમલ પર દેખરેખ-નિયત્રણ રાખવા બાબત, રજ્યા સરકાર, જાહેર કરેલી સેવાઓ સમયસર મળી રહે
તે માટે અને અધિનિયમની જુદી જુદી જોગવાઈઓ પર દેખરેખ-નિયત્રણ રાખવા માટે ઈન્કોરેશન ચોન્ડ
કોપ્યુનિકેશન ટેકનોલોજી/ ઈ-ગવરનન્સની ઉપયોગથી કેન્દ્રીકૃત દેખરેખ-નિયત્રણ પદ્ધતિ, શારી રીતી
જોઈશે.

૨૦. પુરસ્કાર(ચોચોડી).- (૧) દરેક વર્ષના અંતે, તે વર્ષ અધિનિયમ હેઠળ કોઇ કસ્ટર(ચોચોડી) કરેલ ન હોય તેવા
અપિકારીઓ અથવા સેવા પરી પાડનારની યાદી પરિષિદ્ધ કરવી જોઈશે અને જાહેર સત્તામંડળના વડાઓ
નમૂના-“૭” મુજૂબ પ્રશ્નાસાપત્ર આપવો જોઈશે. તેની નોંધ, સંબંધિત અપિકારી/કર્મચારીના વાણિક માનગી
અહેવાલ (ACR)માં પણ કરવી જોઈશે. આવા અપિકારીઓના નામની, પુરસ્કાર (ચોચોડી) પાછે રજ્યા
સરકારને લલાયણ કરવી જોઈશે.

(૨) રજ્યા સરકાર, તે વર્ષે જે અપિકારીઓ અથવા સેવા પરી પાડનાર, જેમની સામે કોઇ કસ્ટર કંયાળી
નોંધ કરવામાં આવેલ ન હોય, તેમને ઈન્સામ (રિવોર્ડ) આપી શકે, જીથી કરીને રજ્યાના સરકારી
કર્મચારીઓને પ્રોત્સાહન મળી શકે અને તેમની કાર્યક્ષમતામાં વધારો થઈ શકે.આ માટે સત્તામંડળ
સત્તાધિકારીએ, દરેક વર્ષના અંતે આવા નાંગોની લલાયણ રજ્યા સરકારને કરવી જોઈશે. રજ્યા
સરકાર, એવા અપિકારીઓ માટે ઉચ્ચિત ઈન્સામ (રિવોર્ડ) નિયત કરી શકશે.

નમૂળો-ક

(કુચો નિયમ ૪)

ડિસ્પ્લે બોર્ડ (રાજ્ય ચિહ્ન)

(કેરીમાં ઉપલબ્ધ જાહેર કરેલી સેવાઓ સંબંધિત માહિતી પ્રદાયિત કરતું બોર્ડ)

ગુજરાત (જાહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩.

કશેરીનું નામ:

ગામ/તાલુકો/જિલ્લાનું નામ :

અનુસૂચિત (નિયત/નિર્ધારિત) સેવાઓ:

સંખ્યા/નામંક	સેવાઓની વાર્ષી	દસ્તાવેજોની વાર્ષી	મુકરર અધિકારીનું નામ	(જાહેર કરેલી સેવા પૂરી પાડ વા માટે) મુકરર અધિકારી માટેની સમયમર્યાદા	ફરિયાદ નિવારણ અધિકારીનું નામ અને સરનામું	ફરિયાદ નિવારણ અધિકારી વારા (અરજીનો) નિકાલ કરવા માટેની સમયમર્યાદા	મુકરર સત્તાધિકારીએ અને રાજ્ય અપીલ સત્તામંડળનું સરનામું	મુકરર સત્તાધિકારી અને રાજ્ય અપીલ સત્તામંડળ વારા (અરજીનો) નિકાલ કરવા માટેની સમયમર્યાદા
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯

અરજી આપવા અને સ્વીકારવા અધિકૃત વ્યક્તિનું નામ અને હોદ્દો:

નાગરિકોને સૂચનો:-

- > સ્વીકૃતિની પહોંચ ફરજિયાતપણે મેળવવી.
- > સેવામાં વિલંબ થાય / ના મળે ,તો સ્વીકૃતિની પહોંચ સાથે ફરિયાદ નિવારણ અધિકારીનો સંપર્ક કરવો.

વેબસાઇટ:

ઈ-મેઇલ આઇડી:

શ્રેષ્ઠ સેન્ટરનો સંપર્ક નંબર/ હેલ્પ ડેસ્ક નંબર:

નમૂનો-ગુ

(જુઓ નિયમ ૪(૨) અથવા નિયમ ૮(૨))

મુકર અધિકારી/ ફરિયાદ નિવારક અધિકારીએ આપવાની પડોંચ.

૧.	સરનામા સાથે અરજદાર/ ફરિયાદીનું નામ.	
૨.	અરજી/ ફરિયાદની તારીખ	
૩.	યુનિક (અનાન્ય) પડોંચ નંબર	
૪.	હોદા અને સરનામા સાથે મુકર અધિકારી/ ફરિયાદ નિવારક અધિકારીનું નામ	
૫.	માંગેલ સેવાઓ/ ફરિયાદની વિગતો	
૬.	સ્વીકાર કરેલ છે ? (હા/ના)	
૭.	સેવાઓ આપવાની સૂચિત તારીખ/ નિવારકની સૂચિત સમય મર્યાદા	
૮.	અસ્વીકાર (કારણો સહિત)	

સ્થળ :

તારીખ :

મુકર અધિકારી/ ફરિયાદ નિવારક અધિકારીની

સહી અને સિક્કો

નમૂનો-ગુ

(જુઓ નિયમ ૮(૧))

ફરિયાદ નિવારક અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરવા આટેનો નમૂનો.

ફરિયાદ નિવારક અધિકારી,

સંબંધિત જાહેર સત્તામંડળનું નામ

સર : -

કૃ. શ્રી/શ્રીમતી/કૃ.

(મુકર અધિકારીનું નામ : અને હોદી) દારો
સેવા (વિનાતી કરેલ જાહેર સેવાની વિગતો) પૂરી નહિ પાડવા/ વિલબધી પૂરી પાડવા સામે
ફરિયાદ કરવા ઈશ્વરું છું.

ના રોજ ના રોજ

સેવાઓ માટે અરજી કરી હતી. તેમ છતાં, સેવાઓ પૂરી
ડિવસોની દરાવેલ સમય મર્યાદાની અંદર પૂરી પાડી ન હતી.

> કૃ. આથી, જાહેર કરું છું કે હું ભારતનો નાગરિક છું.

➤ હું, આથી, જાહેર કરું છું કે ઉપરની વિગતો, મારી ઉત્તમ જાજા અને માન્યતા પ્રમાણે ખરી છે.

ફરિયાદીનું નામ અને સહી :

સરનામું :

ટેલફોન નં./ મોબાઇલ નં.

સ્થળ :

તારીખ :

ફરિયાદ મોકલવાની રીત :

અડાકા : ૧. મુકરર અધિકારીએ કાઢી આપીલ પણોચની નકલ.

નષ્ટૂનો-ધ

(જુઓ નિયમ-૧૩ (૧) અથવા નિયમ ૧૫ (૧))

મુકરર સત્તાપિકારી અથવા રાજ્ય અપીલ સત્તામંડળ સમક્ષ અપીલ દાખલ કરવા માટેનો નમૂનો.

પ્રતિ,

મુકરર સત્તાપિકારી/ રાજ્ય અપીલ સત્તામંડળ,

સરનામું

હું તા.....ના ફરિયાદ નિવારણ અધિકારી/ મુકરર સત્તાપિકારી..... (નામ અને સરનામું)ના નિર્ણય વિરુદ્ધ અપીલ દાખલ કરવા હશ્યું છું.

મને, નીચેના કારણોને લીધે સદરહુ નિર્ણય/ હુકમ અન્યાયી અને ગેરવાજબી હોવાનું જણાય છે.

સત્તામંડળ, ફરિયાદ નિવારણ અધિકારી/ મુકરર સત્તાપિકારીનો નિર્ણય/ હુકમ રદ કરી શકશે અને તે, ન્યાયી ગાણે તેવો કોઈ વધારાનો હુકમ અથવા આદેશો પસાર કરી શકશે.

➤ હું, આથી, જાહેર કરું છું કે હું ભારતનો નાગરિક છું.

➤ હું, આથી, જાહેર કરું છું કે ઉપરની વિગતો, મારી ઉત્તમ જાજા અને માન્યતા પ્રમાણે ખરી છે.

અપીલ કરનારની સહી :

સરનામું :

ટેલફોન નં./ મોબાઇલ નં.

સ્થળ :

તારીખ :

આપીલ રોકદુવાની રીત :

અડાકા:-

१. મુકર્ર અધિકારીએ કાઢી આપેલ પહોંચની નકલ.
૨. ફરિયાદ નિવારણ અધિકારીએ કાઢી આપેલ પહોંચની નકલ.
૩. ફરિયાદ નિવારણ અધિકારીના નિર્ણયની નકલ (ફરિયાદ નિવારણ અધિકારી વિરુદ્ધની અપીલના ડિસ્પાન્સામાં),
૪. મુકર્ર સત્તાઅધિકારીએ કાઢી આપેલ પહોંચની નકલ (મુકર્ર સત્તાઅધિકારી વિરુદ્ધની અપીલના ડિસ્પાન્સામાં),
૫. મુકર્ર સત્તાઅધિકારીના નિર્ણયની નકલ (મુકર્ર સત્તાઅધિકારી વિરુદ્ધની અપીલના ડિસ્પાન્સામાં)

નમૂનો-૩

(જુઓ નિયમ ૧૩ (૩) અથવા નિયમ ૧૫(૨))

મુકર્ર સત્તાઅધિકારી/ રાજ્ય અપીલ સત્તામંડળ આપવાની પહોંચ.

૧.	સરનામા સાથે અપીલ કરનારનું નામ	
૨.	સંબંધિત જહેર સત્તામંડળનું નામ અને સરનામું	
૩.	પ્રતીવાદીનું નામ અને હોદ્દો/ સરનામું	
૪.	અપીલ કર્યાની તારીખ	
૫.	યુનિક (અનન્ય) પહોંચ નંબર	
૬.	માંગેલ સેવાઓ/ ફરિયાદની વિગતો	

સ્થળ :

તારીખ :

મુકર્ર સત્તાઅધિકારી/ રાજ્ય અપીલ સત્તામંડળની

સહી અને સિક્કો.

નમૂનો-૩-૧

(જુઓ નિયમ ૧૭)

મુકર્ર અધિકારીએ નિભાવવાનું રાશિસ્ટર.

પદ અને હોદ્દો :

સરનામું :

અનુ નમાંક	સરનામા સાથે અરજદારનું નામ અને પહોંચ નંબર	માંગેલ સેવાઓની વિગતો	અરજીનો અરવીકાર કરવા આટેના કારણો, કોઈ હોય તો, તે	આપેલ સેવાઓની તારીખ	સેવાઓ પૂરી પાડવાનો ઈનકાર કર્યો હોય તો, તેના કારણો	વિલંબ થયેલ દિવસોની સંખ્યા
૧	૨	૩	૪	૫	૬	૭

નમૂળો-ચ-૮

(જુઓ નિયમ ૧૭)

ફરિયાદ નિવારણ અધિકારીએ નિબાવવાનું રજિસ્ટર.

નામ અને હોદ્દો.-

સરનામું.-

અનુ- ક્રમાંક	ફરિયાદિનું નામ અને સરનામું	પહોંચ નંબર સાથે ફરિયાદ કર્યાની તારીખ	માંગેલ સેવાઓની વિગતો	જેણી વિરુદ્ધ ફરિયાદ કરાયેલ હોય તે અધિકારીનું નામ અને હોદ્દો	અરજણનો અસ્વીકાર કરવા માટેના કારણો, કોઈ હોય તે, તે	ફરિયાદ માટેનો આધાર	માગેલ દાદ	ફરિયાદનો નિકાલ કર્યાની તારીખ	વિશેષ નોંધ
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦

નમૂળો-ચ-૯

(જુઓ નિયમ ૧૭)

મુકર્ર સત્તાઅધિકારીએ નિબાવવાનું રજિસ્ટર.

નામ અને હોદ્દો.-

સરનામું.-

અનુ- ક્રમાંક	અપીલ કરનારનું નામ અને સરનામું	પહોંચ નંબર સાથે અપીલની તારીખ	માંગેલ સેવાઓની વિગતો	ફરિયાદનો અસ્વીકાર કરવા માટેના કારણો, કોઈ હોય તે, તે	અપીલ માટેનો આધાર	મુકર્ર અધિકારીનું નામ અને હોદ્દો	ફરિયાદ નિવારણ અધિકારી (જ.આર. ઓ.)નું નામ અને હોદ્દો	અપીલનો નિકાલ કર્યાની તારીખ	વિશેષ નોંધ
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦

33/26

નામ્બર-ચ-૪

(જુઝો નિયમ ૧૭)

રાજ્ય અપીલ સત્તાંદળે નિબાવવાનું રજિસ્ટર.

નામ અને હોદ્ડો.-

સરનામું.-

અનુ ક્રમાંક	અપીલ કરનારનું નામ અને સરનામું	પહોંચ નંબર સાથે એવટની	માંગેલ સેવાઓની વિગતો	અપીલનો અસીકાર કરવા માટેના કોઈ કારણો, હોય તો, તે	અપીલ માટેનો આધાર	મુકરર અવિકારીનું નામ અને હોદ્ડો	શરિયાદ નિવારણ (જ.આર.ઓ.)નું નામ અને હોદ્ડો	મુકરર અવિકારી નામ અને હોદ્ડો	અપીલનો સત્તાંદળીનું નામ અને હોદ્ડો	અપીલનો નિકાલ કર્યાની તારીખ	વિરોધ નોંધ
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦	૧૧	

નમૂનો-૭

(જુઓ નિયમ ૨૦)

પ્રસંગાપત્રનો મુસદ્દે

પ્રતિ,

અધિકારીનું નામ અને છોડ્યે

તે ગૌરવની બાબત છે કે તમે સમગ્ર વર્ષ દરમિયાન નાગરિકોને ગુજરાત (જહેર સેવાઓ અંગેનો નાગરિકોનો અધિકાર) અધિનિયમ, ૨૦૧૩ હેઠળની સેવાઓ સમયસર પૂરી પાડેલ છે. તમે આપેલ સર્વોન્તુષ્ટ અને સમયસરની સેવાઓને જરૂરો, વિભાગો અને સરકારે સારી નામના પ્રારંત કરેલ છે અને અધિનિયમ અને સરકારે લીધેલ વહીવટી સુધીરણાના પગલાં એટે નાગરિકીયાં વિશ્વાસ સંપાદિત થવામાં પરિષ્કારેલ છે.

એવી આશા રાખવામાં આવે છે કે કર્મચારીઓ તમારી નમૂનારૂપ/ આર્દ્ધ સેવામાંથી ગ્રોસાઇન અનો ઉત્સાહ મળવશે. વર્ષમાં તમે આપેલ ઉત્કૃષ્ટ (કસ્ટર રહિત) સેવા માટે સરકારી પ્રસંગાને રેકર્ડ પર મૂકવાનું ગોર્ખે ગમશે.

ભવિષ્યમાં તમે ઉત્તોતર સફળતા મેળવો એવી શુદ્ધેશ્વા.

જહેર સત્તામંડળના વડાની સહી અને સિક્કો

ગુજરાતના રાજ્યપાલના હુકમથી અને તેમના નામે,

ભારત બી. પટેલ,
સરકારના નામબાબતિ.

સરકારી મધ્યસ્થ મુદ્દ્યાલય, ગાંધીનગર